

To.

BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai – 400001.

Scrip Code: 515085 **ISIN:** INE298E01022

<u>Subject: - Submission of Pre dispatch Newspaper Publication of the 36th Annual General Meeting Notice.</u>

Dear Sir/Ma'am.

Pursuant to Regulation 30 read with Schedule III Part A Para A and Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed clippings of the newspaper publication Financial Express, (English language newspaper and Gujarati language having Nationwide circulation), in compliance with Ministry of Corporate Affairs General Circular nos. 14/2020,17/2020, 20/2020, 02/2021, 21/2021 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021 and December 14, 2021 respectively, intimating that 36th Annual General Meeting of the Company will be held on Monday, July 18, 2022 at 11:30 A.M. (IST) through Video Conferencing /Other Audio-Visual Means.

The above information is also available on the Website of the Company www.restile.com.

This is for your information and records.

Thanking You.

Yours Faithfully,

FOR, RESTILE CERAMICS LIMITED

DHARMENDRA BHALIYA COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER MEMBERSHIP NO. A63699

Encl.: As above

RESTILE CERAMICS LIMITED

Regd. Office: 204, Sakar Complex, Opp. ABS Tower, Vaccine Crossing, Old Padra Road, Vadodara, Gujarat - 390015, India. CIN: L26931GJ1986PLC102350

Branch Office: D.No.1-10-77, 5th Floor, Varun Towers, Opp. Hyderabad Public School, Begumpet, Hyderabad - 500 016. E-mail: restile@accountscare.com, works@restile.com, Website: www.restile.com?h. No. 9998219763

TATA CAPITAL HOUSING FINANCE LTD. TATA Regd. Office: 11th Floor, Tower A, Peninsula Business Park, Ganpatrao Kadam Marg, Lower Parel, Mumbai-400013. CIN No. U67190MH2008PLC187552

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY) (As per Appendix 8(1) of the Security Interest Enforcement Rules, 2002) Whereas, the undersigned being the Authorized Officer of the TATA Capital Housing Finance Limited. under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice calling upon the borrowers to repay the

amount mentioned in the notice within 60 days from the date of the said notice. The borrower, having failed to repay the amount, notice is hereby given to the borrower, in particular and public, in general, that the undersigned has taken physical possession of the property described herein view of order passed by the District Magistrate, Mehsana in below mentioned CC No. through the Executive Magistrate/Mamilatdar and the said Executive Magistrate//Mamilatdar handed over the physical possession to the undersigned Authorised Officer. The borrowers, in particular, and the public n general, are hereby cautioned not to deal with property and any dealings with the property will be subject to the charge of the TATA Capital Housing Finance Limited, for an amount referred to below along with interest thereon and penal interest, charges, costs etc. from the date of demand notice. The borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time

Loan	Name of Obligor(s)/	Amount as	Demand notice dt.	order Date
A/C No.	Legal Heir(s)/ Legal Representative(s)	per Demand Notice	Date of Possession	DM Case No
98774 37	Mr. Komal Rameshkumar Modi (Borrower) Mrs. Shvetaben Komalbhai	Rs.	5-May-21	3-Mar-22
***	Modi (co-Borrower) and Mr.Rameshbhai Chimanial Modi (co-Borrower)	482949/-	17-Jun-22	761-764/2022

property bearing Flat no. 010, on Ground Floor in Building No. "A" carpet area admeasuring 21.91 Sq. Mtrs., along with undivided share proportionate share in the underneath land of the building and all internal and external rights thereto of the premises/campus known as "SHUBH SHUKRA", constricted on non-agriculture land for residential use bearing Survey No. 405, Admeasuring 12011 Sq. Meters, paiki 10911 Sq. Meters, C.S. No. 1500, Situate at Moje Village; Visnagar, Taluka & Sub District : Visnagar, District: Mahesana of Gujarat. Bounded As Follows :- East By: Flat No. A - 005, West By: Society Road, North By: Staircase, South By: Flat No. A - 009."

Rs. 4-May-21 3-Mar-22 9871 Mrs. Snehal Jigarbhai Modi (Borrower) Mr. Jigarbhai Rameshkumar Modi (co-Borrower) 483147/- 17-Jun-22 765-767/2022 231 Description of Secured Assets/Immovable Properties: "All the rights, piece & parcel of Immovable property bearing Flat no. 001, on Ground Floor in Building No. A, admeasuring 42.58 Sq. Mtrs., i.e. 458 sq. ft. Undivided share proportionate share in the underneath land of the building and all internal and external rights thereto of the premises/campus known as "Shubh Shukra", constricted on non-agriculture land for residential use Survey No. 405, Admeasuring 12011 Sq. Meters, paiki 10911 Sq. Meters, C.S. No. 1500, Situate at Moje Village: Visnagar, Taluka: Visnagar, District: Mahesana of Gujarat. Bounded As Follows: - East By : Flat No. A - 004, West By : Society internal Road, North By : Society internal Road, South By: Flat No. A-010*

Date: - 21/06/2022 Sd/-Authorised Officer. Place: - Gujarat For Tata Capital Housing Finance Limited

Pnb पंजाब नैश्ननल बैंक 🖣 punjab national bank CIRCLE OFFICE, SASTRA DIVISION, 3RD FLOOR, SECTOR - 16, GH - 4.5, GANDHINAGAR-382016. EMAIL:- cs8226@pnb.co.in

Appendix-IV (See Rule 8(1)) POSSESSION NOTICE (For immovable Property Whereas, The undersigned being the Authorised Officer of Puniab National Bank, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred upon me under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 01.03.2022 calling upon the Borrowers/Guarantors/Mortgagors M/s Himadri Construction (Borrower Firm), Mr. Prakashkumar Shankarlal Parmar (Proprietor & Guarantor), Mr. Harshadkumar Shankarlai Parmar and Mrs. Shantaben Mohanlai Chamar to repay the amount mentioned in the notice being Rs. 13,13,371.58/-(Rupees Thirteen Lakhs Thirteen Thousand Three Hundred Seventy One and Paisa Fifty Eight Only) as on 28.02.2022 payable with further interest and expenses until payment in full, within 60 days from the date of receipt of the said notice less recovery if any.

The Borrowers/Guarantors/Mortgagors having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Guarantors/Mortgagors and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said Act read with Rule 8 of the said

rules on this 16th day of June, the year 2022. The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrowers/Guarantors/Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Punjab National Bank, for an amount of being Rs. 13,13,371.58/-(Rupees Thirteen Lakhs Thirteen Thousand Three Hundred Seventy One and Paisa Fifty Eight Only) as on 28.02.2022 payable with further interest and costs thereon until payments/realization in full.

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

1. Plot no. 75, NA Land adm.11418 sq.mtrs. and built up area adm. 39.52 sq.mtrs R.S.No.79, CS no.321, Sheet No.130 of patan sim, Muni Census no.1/11/79 Siddhraj nagar colony, Rajmahal road, sim of Gungdi pati, tal. Patan, Gujarat, Owned By Mrs. Shantaben Mohanial Chamar. The property is bounded by. East: - Tenament no.66, West:- Road of Siddhraj nagar colony, North:;- Tenament no.68, South: Tenament no. 76

Shop no. F-53, 1st floor, Devdarshan complex, adm. 9.84.76 sq.mtrs. R.S. No. 62 paiki CS no.335p, Sheet no.130 of Patan sim opp. Santokba Hall Rajmahal Road. Patan Owned By Mr. Harshadkumar Shankarlal Parmar. The property is bounded by: East: - Shop/Office no. 52, West:-Common Passage, North - Shop/Office no. 51 South: - Common Passage

Date: 16.06.2022 (Bhavin Shah) Authorised Officer **Puniab National Bank** Place: Patan

Bank of India

date of receipt of the said notice.

NARANPURA WADAJ BRANCH Ankur Char Rasta, Ahmedabad-38000° Tele: 079-27471181, IFSC CODE:BKID0002018

POSSESSION NOTICE

See rule-8(1)] (for Immovable property) Whereas, the undersigned, being the Authorised Officer of BANK OF INDIA under section the Securitisation & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferrednunder Section 13(12) read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002 issued a demand notice dated 01.03.2019 calling upon the Borrower Mr. Nitinkumar Subhashchandra Mishra to repay the amount mentioned in the notice being Rs.15,15,582 (Rupees Fifteen Lakh fifteen thousand five hundred eighty two only) + interest within 60 days from the

The Borrower having failed to repay the said amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on her under Sections 13 (4) of the said Act read with Rules 8 of the Said Rules, on this 15th day of June of the year 2022.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of BANK OF INDIA for an amount Rs.15,15,582 (Rupees Fifteen Lakh fifteen thousand five hundre eighty two only) and interest plus other charges theron.

The borrower's attention is invited to provisions of sub-section(8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property All that part and parcel of the property consisting of flat no 504 having super built up area of 972 Sq Feet i.e. 90.30 Sq.meters located on 5th floor of block 9E constructed on land bearing revenue survey No 1017/ C of mouie Sachana Taluka Viramgam in the Registration sub District viramgam and district Ahmedabd in the project known as "AAGAM 99 Residency * phase -II together with undivided proportionate share admeasuring 49.39 Sq.yards i.e.40.46 Sq.Meters in all that Non Agricultural land admeasuring 28025 Sq.Meters bearing Revenue Survey

No 1017/A admeasuring 6880 Sq.meter and survey No 1017/B

admeasuring 10624 Sq.meters and survey No 1017/C admeasuring

10521 Sq.Meters situate lying and being mouje sachana Taluka Viramgam

in the registration Sub District Viramgam and District Ahmedabad

alongwith rights to use the common amenities and facilities in the said project developed on the larger land On or towords North by ; Road & Block 9 D On or towards south by : Flat No 9E-501

On or towards East by : Road & Block 9B

On or towards West by : Flat No 9E-503

Date :: 15.06.2022

Authorized Officer Bank of India Place: Ahmedabad

set out in the notice calling the 36th AGM.

whom they maintain their demat accounts.

Manner of casting vote(s) through e-voting:

electronic voting system (e-voting).

cameo@cameoindia.com

e-voting during the process of AGM and VC, www.evotingindia.com.

also be available on the website of the Company, 8 SE and CDSL.



ADITYA BIRLA ADITYA BIRLA HOUSING FINANCE LTD. Registered Office: Indian Rayon Compound, Veraval, Gujarat 36226 Branch Office: Aditya Birla Housing Finance Limited, Unit No. 201 & 202, 2nd Floor, A 1 Smeet, Sarabhai Campus, Near Genda Circle, Inorbit Mall Road, Gorwa Road, Vadodara- 390023

SALE NOTICE [Rule 9(1) of Security Interest (Enforcement) Rules 2002]

SALE BY PRIVATE TREATY OF IMMOVABLE ASSET CHARGED TO ADITYA BIRLA HOUSING FINANCE LIMITED UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002. ("SARFAESI ACT")

The undersigned being the Authorized Officer of Aditya Birla Housing Finance Limited (hereinafter referred to as "ABHFL") has taken the physical possession of the immovable property being "All that piece and parcel of land and building consisting of B-410, Neel Deep Towers, opp. GSFC Fertilizer Nagar, Moje, Dashrath, Vadodara, Gujarat- 391740 (hereinafter referred to as "Secured Asset") under Section 13(4) of the Securitization & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafter referred to as "SARFAESI Act, 2002") which stood secured in favor of ABHFL towards financial facility, its outstanding dues of INR 11,72,784/- (Rupees Eleven Lacs Seventy Two Thousand Seven Hundred Eighty Four only) as on 10.09.2019 and further interest and other expenses incurred thereon till the date of realization to the Borrowers/Co-Borrowers Mr. Gopal Bhavarlal Suthar and Mrs. Vina Devi Gopal Lal Suthar (hereinafter referred to as "Borrowers/Co-Borrowers").

That on failure of the public auctions/e-auctions of Secured asset the undersigned is enforcing its security interest against the said Secured Asset by way of sale through private treaty under the provisions of SARFAESI Act, 2002 and rules framed thereunder. The Authorized Officer has received an expression of interest from a prospective purchaser towards purchase of the abovementioned Secured Asset Now, the Authorized Officer hereby giving the Notice to sell the aforesaid Secured Asset by Private Treaty in terms of Rule 8 and 9 of the Security Interest (Enforcement) Rules 2002. The Sale will be effected on "AS IS WHERE IS BASIS", "AS IS WHAT IS BASIS" and "WHATEVER THEREIS BASIS" on or after 07-07-2022, for recovery of INR 11,72,784/- (Rupees Eleven Lacs Seventy Two Thousand Seven Hundred Eighty Four only) as on 10.09.2019 due to ABHFL from the Borrowers/Co-Borrowers. The reserve price of the Secured Asset is fixed at INR 8,00,000/- (Rupees Eight Lacs only).

The Borrowers/Co-Borrowers are hereby informed that all the requisitions under the provisions of SARFAESI Act, 2002 and the Security Interest (Enforcement) Rules, 2002 have been complied with, and ABHFL is now under the process of enforcing its security interest by effecting sale of the Secured Asset as mentioned herein by way of private treaty as prescribed under the provisions of Rule 8 (5) of Security Interest (Enforcement) Rules, 2002.

Further the Borrowers/Co-Borrowers attention is invited to provisions of sub-section (8) of Section 13 of SARFAESI Act, 2002 in respect of time available, to redeem the said Secured Asset.

Date: 21-06-2022 Place: Vadodara

INFORMATION REGARDING 36TH ANNUAL GENERAL MEETING OF

RESTILE CERAMICS LTD.

The Thirty-Sixth Annual General Meeting of RESTILE CERAMICS LTD. (the 'Company') will be held through Video Conferencing ("VC")/ other audio-visual means ("OAVM") on Monday, July 18, 2022 at 11:30 A.M. (IST), in compliance with all the

applicable provisions of the Companies Act, 2013 and relevant rules made thereunder and the Securities and Exchange

Corporate Affairs (MCA) and Circular no. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020, SEBI/HO/CFD/

OAVM mode shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.

Board of India ("the SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), as

amended from time to time, read with General Circular Nos. 14/2020 dated April, 08, 2020, 17/2020 dated April 13, 2020,

CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13,2022 issued by the

respect to such participation will be provided in the notice convening the AGM. Members participating through the VC/

In compliance with the aforesaid circulars, notice of the 36th AGM along with the Annual Report for the Financial Year

2021-22, will be sent only through electronic mode to those members whose email addresses are registered with the

of Central Depository Services (India) Limited ("CDSL") an agency appointed for conducting Remote e-voting, e-voting,

Manner of registering/updating (1). Email addresses in order to facilitate the Company to serve the documents through

with the Company, are requested to register/update the same with the Company by sending an Email at restile

iii. Alternatively, Members can update their e-mail address, Mobile No., PAN and Bank Accounts Details on the link :-

Company/Depositories. Members may note that the said notice and Annual Report will also be available on the Company's website www.restile.com, website of the Stock Exchange i.e., BSE Limited ("BSE") at www.bseindia.com and on the website

i. Members holding shares in physical mode, who have not registered/ updated their email addresses/Bank Account Details

ii. Members holding shares in dematerialized mode, who have not registered/updated their email addresses/ Bank Account

. Members will have an opportunity to cast their votes on the business as set out in the Notice of the 36th AGM through

ii. The manner of voting remotely (remote e-voting) by members holding shares in dematerialized mode, physical mode and

iii. The facility of e-voting through electronic voting system will also be made available at the AGM. Only those shareholders,

who are present in the AGM through VC/ OAVM facility and have not cast their vote on the Resolutions through remote

e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system available during

particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-voting or e-voting during the process

Members are requested to carefully read all the Notes set out in the Notice of the 36th AGM dated July 18, 2022 and in

for members who have not registered their email addresses has been provided in the Notice of the AGM. The details will

@accountscare.com by quoting their Folio Number and attaching a self-attested copy of PAN, Aadhaar Card and cancelled

Details with their Depository Participants, are requested to register/update the same with the Depository Participants with

Securities and Exchange Board of India (SEBI) (hereinafter collectively referred to as "SBI Circulars"), to transact the business

Members will be able to attend the 36th AGM through VC/OAVM mode only. The detailed instructions with

20/2020 dated May 05, 2020 and 02/2021 dated January 13,2021 and other applicable circulars, if any issued by Ministry of

Authorized Officer (Aditya Birla Housing Finance Limited)

BEFORE THE DISTRICT CONSUMER DISPUTES REDERSSAL COMMISSION AT CHITRADURGA C.C.No.504/2019

COMPLAINANT:-

Sridhara G.T.

OPPONENTS: Plyush Kumar and others. Opponent No.3

Gujarath State-394 107.

Rahul Adhvaryu, Installment and achinery Manufacturing/ delivery Head Way Corporation, Office No.304/A(City Groups), Saipoojar Residency, Manish Chokri Amrolin Near Salbaba Temple, Seeral

NOTICE TO OPPONENT No.3

WHEREAS. Complainant has filed the above case against the Opponents for recovery of amount along with interest The Commission has issued notice to the Opponent No.3, but it was not

served to the Opponent No.3.

Therefore, this notice is issued to Opponent No.3 to appear before the District Consumer Commission, Chitradurga, Karnataka on.04.07.2022 at 11.30 a.m., either personally or through authorized Counsel, failing which the matter will be heard and decided exparte.

This notice is given and issued as per the direction of the Commission with seal and sign on this day 08.06.2022

(ASHOK V.) Advocate for Complainant

R.Chandrashekei Assistant Registrar Cum Assistant Administrative Office **District Consume** Redressal Commision Chitradurga-577501



POONAWALLA HOUSING FINANCE LIMITED

(FORMERLY, MAGMA HOUSING FINANCE LIMITED) REGD. OFF: 602, 6th FLOOR, ZERO ONE IT PARK, SR. No. 79/1. GHORPADI, MUNDHWA ROAD, PUNE - 411036

DEMAND NOTICE UNDER SECTION 13(2) OF THE SARFAESI ACT, 2002

You the below mentioned Borrowers/ Co-borrowers /Guarantors have availed Home loans/Loans against Property facility (ies) by mortgaging your Immovable property/ies from Magma Housing Finance Ltd "MHFL" now renamed as Poonawalla Housing Finance Ltd "PHFL". You defaulted in repayment and therefore, your loan/s was classified as Non-Performing Assets, A Demand Notice under Section 13(2) of Securitisation and Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act 2002 for the recovery of the outstanding dues sent on last known addresses however the same have returned un-served. Hence the contents of which are being published herewith as per Section 13(2) of the Act read with Rule 3(1) of The Security Interest (Enforcement) Rules, 2002 as and by way of Alternate Service upon you.

Details of the Borrowers, Co-borrowers, Guarantors, Securities, Outstanding Dues, Demand Notice sent under Section 13(2) and Amount claimed there under are given as under

SR. NO.	Name of the Borrower, Co-Borrower, Guarantor and Loan Amount	Details of the Secured Asset	Demand Notice Date	Amount Due in Rs.
1.	PABABHAI KALAR, BUDDHIBEN KALAR Loan Amount : Rs. 8,00,000/- Loan No: HM/0225/H/18/100078	ALL THAT PIECE AND PARCEL OF MORTGAGE PROPERTY OF RESIDENTIAL OPEN PLOT NO. 73/2 ADMEASURING 51.24 SQ. MTRS. OF LAND BEARING R.S.NO. 189 OF JOGVAD WHICH WAS CONVERTED INTO NONAGRICULTURE RESIDENTIAL PLOTS BY THE ORDER OF DISTRICT PANCHAYAT JAMNAGAR LOCATED AT JOGVAD, TAL. LALPUR, DIST. JAMNAGAR: BOUNDED AS UNDER. NORTH: SUB PLOT NO. 73/1 IS SITUATED. SOUTH: SUB PLOT NO. 73/3 IS SITUATED. EAST: COMMON PLOT-B IS SITUATED. WEST: 7.50 MTRS. WIDE ROAD IS SITUATED.	28/04/2022	Rs. 540912.17 (Rupees Five Lacs Forty Thousand Nine Hundred Twelve and Seventeen Paisas Only) together with further interest @ 12.50% p.a till repayment.

You the Borrower/s and Co-Borrower/s/Guarantors are therefore called upon to make payment of the above mentioned demanded amount with further interest as mentioned hereinabove in full within 60 Days of this Notice failing which the undersigned shall be constrained to take action under the act to enforce the above-mentioned security/ies. Please Note that as per Section 13(13) of The Said Act, You are in the meanwhile, restrained from transferring the above-referred securities by way of sale, lease or otherwise without our consent.

Place: Gujarat Date: 21.06.2022

Poonawalla Housing Finance Limited (Formerly known as Magma Housing Finance Limited)

Authorised Officer



Hero FinCorp Limited CIN: U74899DL1991PLC046774 Regd. Office: 34, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi-110057. Corporate Office: 09, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi-110057 Phone: 011-4948 7150 | Fax: 011-4948 7197-98

E-mail: litigation@herofincorp.com | Website: www.herofincorp.com POSSESSION NOTICE [(Appendix IV) Rule 8(1)]

Whereas the Authorized officer of Hero FinCorp Limited (HFCL), a Non-Banking Financial Company, under the provisions of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002). (hereinafter referred to as "Act") and in exercise of the powers conferred under Section 13(2) of the Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rule, 2002 issued a Demand Notice dated 07.03.2022, calling upon: M/s H P Enterprise (Borrower) having office at 103, Royal Complex, Bhutkhana

Opposite Dharm Bhakti Complex, Ambaji kadva plot, Rajkot, Gujarat-360004. Mr. Chandulal G Mandalia (Co-Borrower) Proprietor residing at Jaswanti Street No. 1, Opposite Dharm Bhakti Complex, Ambaji kadva plot, Rajkot, Gujarat-360004. Mrs. Shobhnaben C Mandalia (Co-Borrower) Residing at Jaswanti Street No.

Chowk, Dhebar Road, Rajkot, Gujarat-360001 and also at Jaswanti Street No. 1.

 Opposite Dharm Bhakti Complex, Ambaji kadva plot, Rajkot, Gujarat-360004. Mr. Hardik C Mandalia (Co-Borrower) Residing at Jaswanti Street No. 1 Opposite Dharm Bhakti Complex, Ambaji kadva plot, Rajkot, Gujarat-360004. Mr. Pratik Chandulal Mandalla (Co-Borrower) Residing at Jaswanti Street No. 1, Opposite Dharm Bhakti Complex, Ambaji kadva plot, Rajkot, Gujarat-360004. to repay the amount mentioned in the notice Rs.93,06,844.87/- (Rupees Ninety Three Lakhs Six Thousand Eight Hundred Forty Four and Eighty Seven Paise Only) due as on 22.02.2022 along with the applicable interest and other charges

within Sixty (60) days from the date of receipt of the said notice. The Borrower having failed to repay the amount, Notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under subsection (4) of section 13 of Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on 16th day of June, 2022.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of HFCL for an amount of Rs.93,06,844.87/- (Rupees Ninety Three Lakhs Six Thousand Eight Hundred Forty Four and Eighty Seven Paise Only) due as on 22.02.2022 along with the applicable interest and other charges. The attention of the Borrower is invited to provisions of sub-section (8) of section 13

of the Act, in respect of time available, to redeem the secured asset. DEFENDED AS AS ASSESSED IN THE PROPERTY OF THE

DESCR	PTION OF IMMOVABLE PROPERTY/SECURED ASSETS IS AS UNDER:
Property No.1	All that peace and parcel of property being a Residential House having a land area 75-0-0 Sq Yards of Plot No. 6 situated at Rajkot Revenue proposed to be Survey No. 375/1-3/p, City Survey Ward No. 7, City Survey No. 4896/p in Sub Dist & Regi. Dist. Rajkot in the State of Gujarat and bounded as; North: Road, towards it msmt 12-4ft., South: Others Property, towards it msmt 12-4ft., East: Others Houses of the Applicant, towards it msmt 58ft., West: Others Houses of the Applicant, towards it msmt 58ft.
Property No.2	All that peace and percel of property being an office no. 3 on First Floor having carpet area admeasuring 27.69 Sq. Mts. In the building known as "Royal Complex" situated on land bearing City Survey No. 62, 64, 65 Paiki of City Survey Ward No. 8 in Sub District Rajkot in the state of Gujarat and bounded as; North: office no. 2, South: office no. 4 East: common passage, West: dhebar road
Property No.3	All that piece and parcel of property being an office No. 2 on First Floor having carpet area admeasuring 26.05 Sq. Mts. In the building known as "Royal Complex" situated on land bearing City Survey No. 65/3 Paiki of City Survey Ward No. 8/1 in Sub District Rajkot in the state of Gujarat

Property All that peace and parcel of property being an office no. 303 A on Third Floor having carpet area admeasuring 19.80 Sq. Mts. In the building known as "Royal Complex" situated on land bearing City Survey No. 65/3 Paiki of City Survey Ward No. 8/1 in Sub District Rajkot in the state of Gujarat and bounded as; North: office no. 302, South: office no. 303B

East: common passage, West: office door, open terrace then Dhebar road

Place: Rajkot

and bounded as:

North: office no. 1,

East: door of office and common passage,

Hero FinCorp Limited **Authorized Officer**

Date: 21/06/2022

South: office no. 3

Form No. INC-26

[Pursuant to rule 30 the Companies (Incorporation) Rules, 2014] Advertisement to be published in the newspaper for change of registered office of the company from one state to another

Before the Central Government, Regional Director, North Western Region, Ahmedabad In the matter of sub-section (4) of Section 13 of Companies Act, 2013 and clause (a) of sub-rule (5) of rule 30 of the Companies (Incorporation) Rules, 2014 In the matter of Gyankeer Products Private Limited having its registered office at

16/469, Ramdaspura, Village: Pij, Taluka Vaso, Kheda, Gujarat, India, PIN-387230

Notice is hereby given to the General Public that the company proposes to make application to the Central Government under section 13 of the Companies Act, 2013 seeking confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of the special resolution passed at the 02nd Extraordinary General Meeting of 2022-2023 held on 13th June, 2022 to enable the company to change its Registered Office from

"State of Gujarat" to "State of Rajasthan". Any person whose interest is likely to be affected by the proposed change of the registered office of the company may deliver either on the MCA-21 portal (www.mca.gov.in) by filing investor complaint form or cause to be delivered or send by registered post of his/her objections supported by an affidavit stating the nature of his/her interest and grounds of opposition to the Regional Director at the address ROC Bhavan, Opp Rupal Park Society, Behind Ankur Bus Stop, Narangura, Ahmedabad-380013, Gujarat within fourteen days of the date of publication of this notice with a copy to the applicant company at its registered office at the address mentioned below:

Registered Office: 16/469, Ramdaspura, Village: Pij, Taluka Vaso, Kheda, Gujarat, India, PIN-387230

Date: 20.06.2022 For and on behalf of the Applicant Place: Pij Name: Gyan Singh Jhala

> Designation : Director DIN: 06705892 Address: Jhalao Ka Guda, Via Gogunda, The. Gogunda, Udaipur, Rajasthan, India, PIN-313001

Name of borrower(s), Description of the property mortgaged (Secured Asset)

MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LIMITED Narayan Chambers, 2th Floor, Brh. Patang Hotel, Ashram Road, Ahmedabad-380009, Contact : 079-41106500 / 733

Place: Vadodara

Date:20.6.22

POSSESSION NOTICE

(FOR IMMOVABLE PROPERTY) Rule 8(1) of Security Interest (Enforcement Rules 2002) Whereas the undersigned being the authorized officer of the MAS Rural Housing & Mortgage Finance Ltd. under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act - 2002 (54 of 2002) and in exercise of powers conferred under section

Authorized Signatory, Mr. Bharat J. Bhatt (M.) 9714199018

For, MAS Rural Housing & Mortgage Finance Ltd.

Date of Demand | Date of Symbolic | O/s Amount as on date

By Order of the Board - For, RESTILE CERAMICS LIMITED

VIREN RATHOD

MANAGING DIRECTOR

13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 18/01/2022 calling upon the Borrower/Coborrower/Guarantor to repay the amount mentioned in the notice being within Sixty Days from the date of receipt of the said notice. The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower/Co-borrower/Guarantor and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of

The Borrower/Co-borrower/Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the Property will be subject to the charge of the MAS Rural Housing & Mortgage Finance Ltd. as on 18/01/2022 and interest thereon. The Borrower/Co-borrower/Guarantor attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

section 13 of the said [Act] read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002, on this 18rd Day of June of the year 2022.

Sr.	Borrower & Co-Borrower,	Description Of The	Loan A/C No	Date & Amount of
No.	Guarantor Name	Immovable Property	Date of Possesion	Demand Notice
1	Pareshkumar Jeetabhai Patel (Applicant) Jitabhai Narabhai Patel (Coapplicant) Alpeshkumar Jitabhai Patel (Coapplicant) Narendrasinh Bhavansinh Bhati (Guarantor)	ALL THAT PIECE AND PARCEL PROPERTY BEARING PLOT NO.8(AS PER SANAD) HOUSE NO.149 ADMEASURING 116.12 SQ. MTRS. & CONSTRUCTION THREON SITUATED AT AT. MEDH, TA. VADALI, IN THE REGISTRATION DISTRICT & SUB DISTRICT OF SABARKANTHA, GUJARAT.	19.06.2022	Rs.517,509.00 in Words Five Lakhs Seventeen Thousands Five Hundreds Nine Rupees Only as on Date 10/01/2022



Date : 21-06-2022

Place: Sabarkantha

Bandhan Regional Office: Netaji Marg, Nr. Mithakhali Six Roads, Ellisbridge, Ahmedabad-6. Phone: +91-79-26421671-75

SYMBOLIC POSSESSION NOTICE

NOTICE is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, the Authorized Officer issued demand notice to the borrower(s) on the date mentioned against the account stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice. The borrower(s) having failed to repay the amount, notice is hereby given to the public in general and in particular the borrower(s) that the undersigned has taken the symbolic possession of the property described herein below under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on the date mentioned against the account. The borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of the Bank for the amounts, interest, costs and charges thereon. The borrowers'/mortgagors' attention is invited to the provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Loan Account No),25 - 197 197 NO SOMEON NO 1070)	Notice	Possession Notice	of Demand Notice
Mr. Hitesh Prabhudas Munsara Mrs. Kamini Hitesh Munsara 100/18358 & 100/18359	All that piece and parcel of the immovable property situated at Survey No. 53/4, 53/5, 53/A, 55/B, Final Plot No., Tika No. 10, Block/Building No. B, House No. 403 and 404, 4th Floor, Dev Darshan Park, Akshar Nagar Road, Viramgam, Ahmedabad, Gujarat- 382150 and bounded by: Flat No. B/403: North: Passage, East: Flat No. B/402, West: Flat No. B/404, South: Swaminarayan Temple (B.A.P.S) Flat No. B/404: North: Stairs, East: Flat No. B/403, West: City Center Complex, South: Swaminarayan Temple (B.A.P.S)	01.04.2022	16.06.2022	Rs.9,12,707.23 & Rs.3,99,777.42
Mr. Dewanand Shankarlal Koshti Mrs. Laxmi Dewanand Koshti 99/3455	All that piece and parcel of the immovable property situated at Final Plot No. 83, TPS- 57, Block No. E, Flat No. 206, 2nd Floor, Vedikaa Residency, B/s Aaskruti Township, Mouje-Narol, Ahmedabad, Gujarat- 382405 and bounded by: North: Block F, East: Flat No. E/201, West: Society Common Plot, South: Flat No. E-204	06.04.2022	15.06.2022	Rs.6,22,777.50
Place: Ahmedabad		•		Authorised Office

Ahmedabad

Bandhan Bank Limited

financialexp.epapr.in

Date: 16/06/2022

AXIS BANK

કલેક્શનઃ પહેલો માળ, બાલેશ્વર એવન્યુ, એસ. જી. દાઈવે, રાજપથ કલબ સામે, બોક્કદેવ, અમદાવાદ, ગુજરાત - ૩૮૦ ૦૫૪. SG의 희원된 APPENDIX -IV [Rule 8(1)]

વગેરે સદર નોટીસ ની લારીખથી દિન સાઇ (૧૦) માં ભરપાઈ કરી જવા જણાવિલ. નીચે દેલવમાં જણાવેલ કરજદાર/સહકરજદાર/ગીરવેદાર/જામીનદાસને સિક્યુરીટાઇલ્લેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઑક ફાયતાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સિન્ટ ઑફ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૧૦૦૨ દેઠળ આપેલી નોટીસમાં જણાવેલ કરજદાર/સહકરજદાર/ગીરવેદાર/જામીનદાસને સિક્યુરીટાઇલ્લેશન એને લેશેનેલ અન્યોને ખાસ તથા જાદેર જનતાને સભાના રૂપે નોટીસ આપવામાં આવે છે કે નીચે સફી કરનારે તેને ઉપરોક્ત કાયદાના સેક્યાન ૧૩(૪) સાથે નિયામે પૈકી નિયમ ૮ વંચાણે લેતા મળેત સત્તાની રૂપે નીચે જણાવેલ તારીખે નીચ વહેલ બિલ્ડનનો કબ્લે લીધો છે. અને તીચે દેખલમાં ઉદ્યોખ કરેલ કરજદાર/સહકરજદાર/ગીરવેદાર /જામીનદાસને વિશેષ રૂપે અને સામાન્ય રીતે જાદેર જાતાને આથી ચેતવાટી સાપવામાં આવે છે કે સદરકુ મિલકત અંગે કોઈ પણ પ્રકારનો વ્યવસર કરવો નહીં અને તે રીતે વહેલ કોઈપણ વ્યવકાર તે નોટીસમાં જણાવ્યા મુજબ એક્સિસ એક લિ. નીચે દેખલમાં જાતાને કરમ ઉપરાંત આ રકમ પરનું કોન્ટ્રેક્યુઅલ દરે થતું આગળનું વ્યાજ, થયેલ/શનારા અકસ્થિક અને તે રીતે વહેલ કોઈપણ વ્યવકાર તે નોટીસમાં જાણાવ્યા મુજબ એક્સિસ એક લિ. નીચે દેખલમાં જાતાને સાથે પરનું કોન્ટ્રેક્યુઅલ દરે થતું આગળનું વ્યાજ, થયેલ/શનારા અકસ્થિક અર્થા, પક્તર, પ્રાપ્ટેસ વગેરે રકમના બોજ આદીન દરેશે. ગીરને સખેલ સરક્યામતો આપેલા સમારમાં શોડાવવા અંગે કરજદારેનું સર્વકરીને એક્ટ, ૨૦૦૨ના સેક્શન ૧૩ના સબ-સેક્શન (૮) ની જોગવાઈ તરક ધ્યાન દોરવામાં આવે છે.

		THE RESERVE OF THE PARTY OF THE	કર, ૨૦૦૨ના સેક્શન ૧૩ના સબ-સેક્શન (૮) ના જાગવાઇ તરફ અનન દારવાના જાત છે. પિલકતોની વિગતો	act and
	SEVEIR /	हिमान्ड बोटीस तारीण अने जाती शाम (व्यापु+	અચલિત ત્રિલકતોની વિગતો	वारी भ अने प्रशर
しては、一般の一般の大きのできる。	સફ-કરપ્રદારના નામ (૧) અરવીભાઇ ખીપાભાઇ ભાદીયા (૨) ફિમ્પ્લભાઇ અરવીભાઇ ભાદીયા	/ Re 28.16.957.47/- as	ગિલકત લે. ૧ : રહેદાક ખલકત રવવનું સર્ચ બ. 337 પાડ) પાડે અંભળીયા, તાલુકા ખંભાળીયા, જીકો દેવભૃષિ ૧૨.૦૮૫ રકે. મીટર્સ, રામનગર, બજરંગ પાર્ક પાસે, પોરબર કહેવે રોક, ખંભાળીયા, તાલુકા ખંભાળીયા, જીકો દેવભૃષિ ૧૨.૦૮૫ રકે. મીટર્સ, રામનગર, બજરંગ પાર્ક લી મિલકતના બદા ભાગ અને ફિસ્સ સાથે જે કી ફિસ્તભાઈ અરથીભાઈ ભારીયાની માલીકી અને યતુરસીમાં આ કુજલ છે. ચતુરસીમાં આ લાજુ સંગ પહોં છે. અને ક. ૧૫ મીટર, હિતારા આ બાજુ સંગ પહોં છે. 32 પા અને ૯.૨૫ મીટર, હિતારા આ બાજુ સંગ પહોં છે. ૧૨ જ એ ૯.૨૫ મીટર હિતારા આ બાજુ સંગ પહોં છે. ૧૨ જ એ ૯.૨૫ મીટર હિતારા આ બાજુ સંગ પહોં છે. ૧૨ જ એ ૯.૨૫ મીટર અને ૯.૧૫ મીટર હિતારા આ બાજુ સંગ પહોં છે. ૧૫ મીટર્સ અને ૧૫, ગાઉન્ડ કલોર, તેમનળ ૯.૦૫ એ. મીટર્સ અને ૧૫, ગાઉન્ડ કલોર, તેમનળ ૯.૦૫ એ. મીટર્સ અને ૧૫, ગાઉન્ડ કલોર એ માં હિમતભાઈ અરશીનાઈ ભારીયાની માલીકી અને ચતુરસીમાં આ મુજબ છે. ચતુરસીમાં પૂર્વ આ બાજુ પહોંટ મં. ૧૮, પલિમાં આ બાજુ ૧.૪૪ મીટર, ઉત્તરા આ બાજુ પહોંટ મં. ૧૮, પલિમાં આ બાજુ ૧.૪૪ મીટર, ઉત્તરા આ બાજુ ચાઉન્ડ કલોર, ગમાં ૧, ૧૦, સેમકળ એરિયા ૧૦.૬૫ મિલકત તે ૩.૧ રેવેન્યુ સર્ચ લે. ૧૮,૫/પી૧, પહોંટ મં. ૦૬ અને ૯. ચાઉન્ડ કલોર, ગમાં ૧૫, સેમકળ એરિયા ૧૦.૬૫ રહે. મીટર્સ અને ૮,૫૫૫૫ બિલ્ડીંગ એમ્પુડ પલાન અને ગ્રમ તો ૧૮ મુજબ, સેમકલ એરિયા ૧૦.૬૫ રહે. મીટર્સ અને ૧.૫૫૫ બિલ્ડીંગ અને ૧.૪૫ મિલકતના બધા ભાગ અને ફિસ્સા સાથે જે શ્રી ફિમલભાઈ અરથીઆઈ આદીયાની પાર્દીકી અને ચતુરસીમાં આ મુજબ છે. મિલકતના બધા ભાગ અને ફિસ્સા સાથે જે શ્રી ફિમલભાઈ અરથીઆઈ આદીયાની પાર્દીકી અને ચતુરસીમાં આ મુજબ છે. મારા લાલુકા પ્રતાલા આ પણ રોક, દર્તિયાર આ ચતુરસીમાં આ મુજબ છે.	15-06-2022 2113/Gs
2	(૧) નાકુલ રામજીભાઈ ઘેટીયા (૧) જેમીન રામજીભાઈ ઘેટીયા	08-93-2022 / Rs. 38,82,655.90/- as on 25-92-2022	બાયું ગ્રાઇન્ડ રાતા રૂપ કરોણાંક મિલકત, કલેટ નં. 201, બાંધકામ બીનખેતી જમીન ક્ષેત્રકળ પ્લોટ નં. રવ પૈકી, રેચેન્યુ સર્થે નં. ૨/૨/૨ પૈકી, એરિક્યા શીવખ પાર્ક નામે જાણીતું, અવધેશ ટાવર, ખારવા રેડ. ધોલ, જીદરો: જામનગર માં આવેલ અચલિત મિલકતના બાધા ભાગ અને ફિસ્સા સાથે જે સી નાકુલ ટામજીભાઈ ઘોટીયાની માલીકી અને ચતુરસીમાં આ મુજબ છે: પૂર્વ: ૬ મીટર પક્ષેઓ રોડ, પશ્ચિમ પ્લોટ નં. ૨૮, ઉત્તરા દરવાજો અને ખૂંદો પેરોજ અને દક્ષેણાંક ઘર રેચેન્યુ સર્વ નં. ૨/૨/૧ પહોર, દક્ષિણ: પ્લોટ નં. 30.	आंब्रेलि

મહેરબાની કરીને નોંધ લેવા કે કાયદાના સેક્શન ૧૩ (૧૩) અન્વવે નોટીસ મળ્યેથી બેંક પાસે રાખેલ અસલ્યામતો પૈકી એક પણ અંગે તમે વેચાણ, લીઝ કે અન્ય કોઈ રીતે વ્યવહાર બેંકની પૂર્વમંજૂરી સિવાય નહી કરી રાકો. અધિકૃત અધિકારી, એક્સિસ બેંક લિ. Milu: 20-03-2022, 2001: 97214

INFORMATION REGARDING 36TH ANNUAL GENERAL MEETING OF RESTILE CERAMICS LTD.

1. The Thirty-Sixth Annual General Meeting of RESTILE CERAMICS LTD. (the Company') will be held through Video Conferencing ("VC")/ other audio-visual means ("OAVM") on Monday, July 18, 2022 at 11:30 A.M. (IST), in compliance with all the ("VC")/ other audio-visual means ("OAVM") on Monday, July 18, 2022 at 11:30 A.M. (IST), in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and relevant rules made thereunder and the Securities and Exchange applicable ("the SEBI") (Listing Obligations and Disciosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), as Board of India ("the SEBI") (Listing Obligations and Disciosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), as amended from time to time, read with General Circular No. 14/2020 dated April, 08, 2020, 17/2020 dated April 13, 2020, amended from time to time, read with General Circular No. 5281/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12" May, 2020, SEBI/HO/CFD/CD0/CMD1/CIR/P/2020/79 dated 12" May, 2020, SEBI/HO/CFD/CMD1/CIR/P/2021/79 dated 12" May, 2020, SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12" May, 2020, SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12" May, 2020, SEBI/HO/

- In compliance with the aforesald circulars, notice of the 36th AGM along with the Annual Report for the Financial Year and compliance with the arbrevald circulars, honce of the 3oth AGM along with the Annual Report for the Financial Year 2021-22, will be sent only through electronic mode to those members whose email addresses are registered with the Company/Depositories. Members may note that the said notice and Annual Report will also be available on the Company's website www.restile.com, website of the Stock Exchange Le, BSE Limited ("BSE") at www.bseindia.com and on the website website year. Depository Services (India) Limited ("CDSL") an agency appointed for conducting Remote e-voting, e-voting, e-voting during the process of AGM and VC, www.evotingindia.com.
- Manner of registering/updating (1). Email addresses in order to facilitate the Company to serve the documents through
- the electronic mode

 i. Members holding shares in physical mode, who have not registered/ updated their email addresses/Bank Account Details with the Company, are requested to register/update the same with the Company by sending an Email at restile

 @accountscare.com by quoting their Folio Number and attaching a self-attested copy of PAN, Aadhear Card and cancelled
- ii. Members holding shares in dematerialized mode, who have not registered/updated their email addresses/ Bank Account
 Details with their Depository Participants, are requested to register/update the same with the Depository Participants with
 whom they maintain their demat accounts.
- iii.Alternatively, Members can update their e-mail address, Mobile No., PAN and Bank Accounts Details on the link :cameo@cameoindia.com
- Manner of casting vote(s) through e-voting:

 Members will have an opportunity to cast their votes on the business as set out in the Notice of the 36th AGM through
- electronic voting system (e-voting).

 ii. The manner of voting remotely (remote e-voting) by members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email addresses has been provided in the Notice of the AGM. The details will also be available on the website of the Company, B SE and CDSL.

 If the facility of e-voting through electronic voting system will also be made available at the AGM. Only those shareholders, who are present in the AGM through VC/ OAVM facility and have not cast their vote on the Resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system available during the e-CM.
- Members are requested to corefully read all the Notes set out in the Notice of the 36th AGM dated July 18, 2022 and in particular, Instructions for joining the AGM, manner of casting vote through remote e-voting or e-voting during the process

Place: Vadodara Date:20.6.22

By Order of the Board - For, RESTILE CERAMICS LIMITED VIREN RATHOD MANAGING DIRECTOR